

‘ભાગુણના દડવા પારીદારની’

ન્યાતની પડતી તથા ચદ્દતીના કારણો

નવા અંધારણુ મણે ન્યાતનીતી નીથમે

આપણી ન્યાતની પડતીનું મળ કરાય નથી છે. હવે તું વારે-
નારે કા કા લથી પડે છે, ને કિંબે આપણે ત્રૈપ્રેક્ષણિયાર શ્રીમે.
એ લિખે કિયારું કર્તાનું કેવું જાહેર રહે છે, કે જ્ઞાનરે વધ
નાનું હથરું વધી નાતે એકાં કળી ન્યાતનું કાગ. સારી રીતે
ખાંખાં સરદે વધુંને ગણને વધુંને સુખ થાય જોવાં નિરમેણ વૃદ્ધિયા
જે ને કરેબાળનાંનાંને અમદરમાં વાતાં મણે નાંદું શામની કર્માંડા
પ્રેરણી; જેને જે જાણ રીતીનાંનાં જે જામને નિશ્ચી જોકોને
પ્રેરણા જેને જેઓ સીધાં રૂપનાંનું પૂર્ણ કોઈ કુંઠું. એ સીધાંનું
જે વાદતુંદરું, તેઓ વધું કળનું કરાય કેટલું છે એ નીમણની
એ કુંઠું પણી વધી ન્યાત જોડી રહ્યો હર જણ જણ વર-
ણ અને સુદૃષ્ટિ કરવાનાં આવી નથી, કેણી કરીને એ આપ
જામનીથી જે ને ભાદુંસેને ન્યાતનું કાગ કરવાની રૂતા રણી તે

ગુહણતી કોપીરાઈટ રંગાઠ

મળા, અને નીચમાંના વખતને અનુસારે બીજુફુલ દેરહાર ક્રીબો નહિને પરિષ્ઠમે અન્યાસનું અને કાર્યવાદકોને અહેંઅનું રચાન મળું શુંને એરોચેનેગાડું ને કાપીવાદકોનો રોજાયને - હોય તો તેનાસાથું ન કરતો - ન્યાયથી ચાલનાર બીન ગુનેગારોની જીમે પાત્રી હોવી લાગવા તારે બેઠાને બીજું પદ્ધ પાછવાની છુંબ થએ. અને પદ્ધ પડવાથી ન્યાસને એકી બેસી પોતાની ચલતીના નીચેસો કરવાનો વખત હજુ સુધી મળ્યો નથી. અને એકા થઈ દરેક પક્ષનાણાઓ એક બીજી પક્ષની ડેમ પડતી થામ તેને આરોવચાર કરી પડતીના દર વેં પસાર કર્યા, અને આપણી ડોમને કાંઈપણ સુધી અવાના નીચેમ. વગરની કરી મુજા છે:

ઉપરની હુકીકત ઉપરથી એટલું સીદું થાય છે, કે ન્યાસનું કામ ચલાવવાને કે કે માટ્સેસોને નીમેલા, તે તે રોજુસોને ૧૦૦ વર્ષ સુધીને તેમા વંદે વારસેને ન્યાસનું કામ કરવાનો વારસો આપેલો, એંબે પડતીનું કાંઈપણ છે. દરેક આપણે કરી પાણી નવે નાને ન્યાસનું કામ ચલાવવાની નીચેમો પડવાની જરૂર છે. બધા ભાઈઓ ડેમ સુધીની થાય, અને આપણી ડોમના ડેટલાક ભાઈઓ નીર્ધિન જની કાઈ તેજાના ડેટલાનેક તો જોતાના હુકુંબનું બરસ્યું પોપણ કરવાને પદ્ધ અસ્કકત થઈ પડ્યા છે, તેવાળોની રથીતી ડેમ સુધેર અને આપણી પ્રણ ભળાહીન તથા રોગીએ અને અદ્ય આપણથી ઘરીની જાય છે, તે ડેમ બળવાન નીર્ધિની અમે દીર્ઘીયુભની થાય, તેને આરોવચાર કરવાનો વખત હું નશીડ આવ્યો છે. મારે કે નો આપણથી ડોમના લીલાયીતોને છે. તેમજું તો કા તણા ચેલે રોકાનાંની સુલત થઈ છે જગતું જોઈયે, કારણ છે: નેમ કેને વધુ કામત કરતો નથી તેમ તેમ હું પદ્ધુલા જરાણી કોમ તેજ છે.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ગુજરાતી કાણીરાબિદ્ય વિભાગ]

અનુકૂળાંક રૂ ૨૫૮૨ વર્ગીક

પુસ્તકનું નામ ટોચન પુસ્તકાલાઙ્ઘ
ડાયુંદો-

વિષય રુ ૩૫૮૨૫ પા: ૪; દ. ૩૩૫૧૧

मरे नेमने चोताने सुधी धनानी अने पारडाने सुधी करव नी
छन्दा हो, ते तो आवा जिटा अहंकारतो। नक्ष की आगती
मुखरेली वहल भूली नहु नवे सरखी हरेक आधमेने सुख थाय
जेवी रीतधी न्याततु नवु अधारथु करवा अने वर्खतने अनुस-
रता नीयमे बडवा लोकने समझुत करवा युक्तो नदी।

हवे नवेसरथी न्याततु अधारथु सी रीते थाय ते वापे
आपले वीचार करीमे आले तो आपथी न्यातमां ए तः पडवां
छे, ए तडां कार्यवाहको तो एक वीज पक्षनी इम पडती हया
थाय, तेरे आटे रात दीवस. तनतोड महेनत डी रहेवां छे.
जेमो सामा पक्षनी धर्घा राखे छे, वगा चोताना पक्षना भाष्य-
सेने हउ छे. अने राज थाय छे; पण तेमो एवुं समझतां नयी,
हे आपथा पक्षना भाष्यसेने आपले हंडीमे छीमे. ते हडना
जेटले लाकडीना सपाटा आपथाज शरीर उपर पडे छे. अने
आपथीज अरावी थाय छे. कारथु हे -पाठ ए एक आपलुं
दीशट शरीर छे. आटे हवे हरेक आधमेने एवुं अभजतु जोहमे
हे आपथी न्यातमां जेटवा भाष्यसो छे ते भधाज आपथा आध-
मेने छे. जेम करीरना जुदा जुदा अंगो आपथाज हे तेम हरेक
तडमां रहेवां भाष्यसो पण आपथा अगंजेन छे. अने तेमो
जरीन बनसे तो जहर आपथुने पथ्य गरीब जनावसेन. आटे
आपथी न्याततु लहु छन्दनार काठमेने तो हवे पक्षपातनी
धर्घा हंडी हड्हने जेम बहे तेम हरेक आधमेने सुख थाय जेवा
नीयमें करवाने जनती महेनत डरवी जेघमे अने आपले तः
पगरना अधे हरेक भाष्यसो आपथा आधमें छे. एवा दू वीचार
करवो जोहमे अने के पक्षना कार्यवाहकोने एक वीज पक्षनी

ભરાણી કરવાનો દફ સંક્ષેપ છે તે આગેવાન ભાઈએની વાતથી આપણે વીમુખ યધ આપણે આપણી હિન્દ્યાતાની બદલીના વીચાર કરવા જોઈએ અને એ પદ્ધતા રહેલા ડિતચિત્તકીએ પસ્તા અનેસર ભાઈની પડતીના વિચાર ફેરફાળી તરદી નહિ લેતાં બીજા કે ભાઈ એને તડનો બેંગી રોગ લાગ્યો ન હોય તેવાએને સુખી થવાના નાયમો ધરી આપણે અને આપણા વીચારને અગતાં ભાઈએ માથે તડનો વિક્રેપ છાડીને એકાં મળવું જોઈએ, કારણ કે આ તડની આરાનારીમાં સમજુ ભાણુસાંચે હવે માર ન આવો જોઈએ, અને સમજુ ભાણુસાંચે પાતાના અગતાં વીચારવાળાની સાથે વંગર તડના યધ મળવું જોઈએ. ગાંધી ભાદાત્મા તો ડિદુ, મુખદ્વમાન, પારસ્પર અને દેઢને પણ એકન કરવાની ઘણ્ણાણી અયાર પરીશ્રમ કરી રહ્યા છે તો આપણે તો એકજ ન્યાતના ભાઈએને એક મળતા વીચારના ભાણુસાંચે એકાં મળાને આપણને સુખ થાય એવાં નીયમો કરી રે પ્રભાણી આવવાને એવો ડોધપણ જાતના ડર જેવું લાગતું નથી. એક ડર આપણા દરેક પક્ષના આગેવાન ભાઈએનો છે. તેઓ જ્યારે આપણા અને તેમના સુખનો ડોધપણ દાઢાં વીચાર કરતાં જણ્ણાતી નથી અને એમને મળેલી સાનાનો દુરૂપથોગ કરે છે, તો પણ દરેક પક્ષમાં રહેલા વીચારવાન અને ડાઢા પુરુષોએ એ પક્ષના આગેવાન પુરુષોની અગતનાના વીચારને અનુસરીને કંપાં સુખી હુઃખ વડાં કરતું. અને આપણાજ ભાઈએને ખાટા તડાં હંજાણી એકાંજ એને અન્યોન્ય હુઃખી કરી જતે હુઃખ વડાં કરતું. એને અને હવે આસ વિચાર કરવા જોઈએ, જો કે પક્ષના આગેવાન ભાઈએ અન્ય પણ દુરૂમન નથી. પણ આપણા ડીતનો એચો વીચાર નથી, અને રહેલી સાનામાં મહોન્તરા યધ સુખ કરવને જરૂરે હું

કને હુંમાં થાય એવા નીયમો કરી આપણને તે પ્રમાણે ચલાવે છે.
 માટે હવે આપણે એ અગ્રેસર ભાઈઓને પણ સુખ થાય અને
 આપણે પણ સુખી થઇએ એવા નીચારથી એક નવું મંડળ ઉભું
 કરી તેમાં ને ને પક્ષના સમબુદ્ધ અને સુખી ચવાની ઈચ્છાવાળા
 તડના અદંકાર વગરના માણુસોએ એકત્ર થર્ડ ન્યાતનું નવું બોધા-
 રણ કરવાની હવે ખરેખરી જરૂર પડેલી છે. કરણું કે આપણી
 ન્યાતના એગ્રેસર ભાઈઓ તો ન્યાતની ચઢતી કરવાના વીચારને
 કુલી જાહેરે એક બીજી પક્ષની મારામારીમાં પડ્યાં છે. અને દંડવા
 છે. અને દંડી દંડીને ગરીબ બનાવવા છે. એવો એક જાતનો
 ઉપાધી રોગ લાગ્યો છે. માટે સમબુદ્ધ અને વીચારવાળા ડાંબા
 પુરુષોને ને કદાચ આ રોગ લાગ્યો હોય તો એકત્ર અથવા ભાતુ-
 ભાવનાના અભેધથી એ રોગની નાસ્તી કરીને ન્યાતના તમામ
 ભાઈઓનું અલું કરવાના અને એકસંપી બનવાના વીચાર ઉપર
 આવી એક નવું મંડળ ઉભું કરવું જોઈએ. અને એવા નીયમ
 બનાવવા જોઈએ કે હવે પણીથી એ મંડળને તડનો રોગ લાગે નહીં
 હવે નવું મંડળ બાંધવા સંબંધી આપણે વીચાર કરીએ કે કેવા નીયમથી
 એ મંડળ ઉભું કરવું કે તડનો રોગ ન લાગે. એવું ભાવમ પડે
 છે, કે દંડ કરવાથી તડ પડે, દંડ એટલે લાકડી. કાદવના વાસથુમાં
 લાકડી મારીએ તો તડ પડે, અને તે વાસથું પાણી રહેવાને નાશ-
 ભક્ત થાય. માટે દંડ કરવાના ન જાને તો કરીને તડ પડે નહીં
 એ ચાત સીદ થાય છે.

હવે એક સાડા કિર્પણ થાય છે. કે કોઈપણ જાતના અહુદી
 વિશ્વર અંડા સુરક્ષિત રહી થાય નહીં. તેના સમાધાનમાં એટલુંજ કે
 આપણે ભાવા એકઠા ગણાને આપણને દરેકને સુખ થાય એવા

નીચાંગે; બહુભાગીયી બાંધાંગે, અને તે નીવાસી ડેઝ માલુસ વીરદુઃખ
વર્તન કરે, તો જડાંગાંથી તેને પછાર કરી મુક્તાંગે; અને તે એને
ચોટે કરેલાં ગુણાંગી મારી આપે. તો તેને એકવાર કરેલા ગુણાંગી
મારી આપની. જે જે માલુસોને મંડળમાં દાખલ હતું હોય તેમને
દાખલ કરવા, અને કેઅને મંડળમાંથી રણજાહું
આપી નીકળી હતું હોય તેમને નીકળી જવાની શુદ્ધ આપની.
મંતથલ કે મંડળાંતું બારથું ઉથાં રાખતું, જેમને આવતું હોય તે
આવે અને હતું હોય તે જાથી, એ બાજતમાં તહેન સ્વતંત્રતા
આપની જોઈએ. હવે આપણે નવા ઉભા કરવાના મંડળાં બાધણી
કેવી રીતે કરવી. તે વીચાર ઉપર આવીએ.

આપણું જેમ માલુમ પડે છે, કે આપણા ધરડાઓએ જે
બાંધણી બાંધી છે, તે જોઈ તો નથી, પણ આપણે કામદાર માલુસોએ
કરવા નહીં તેથી કરીને ભરાયી શઈ છે. એ હુવાત આપણે આગળ
બાંધી જયા ધીએ. ધરડાઓની કરેલી બાંધણીનો હોય નહીં કાઢતાં
આપણે તેજ સુજલ બાંધણી કરવી જોઈએ. જુઓ કે આપણી
ન્યાતના છર જામે છે, અને બેતાળીસ ગામેનાં ચઠને કુલ ૧૨૦૦
ધરની શબ્દતરી કાલ કરવામાં આવી છે, એ બારસો ધર ન્યાતતું
અસ કરે એટલું બધું ન્યાતતું કામ નથી કેથી આપણા ધરડાઓએ
કુકત આડ ગામ પેકી આસડે ૧૬ માલુસોને ન્યાતે કરેલા નીપમેનો
અમલ કરવાને નીમાં હોય, હેતું અનુગ્રહ કાલ છે મારે આપણે
પણ જેમ જને તેમ કામણી હિસરળતા થના સારુ એટલા બાજના
એટલા માલુસો આ મંડળમાં દાખલ થાય, તેટલા પેકી લે તે જામના
એક કંગર એ માલુસોને જાપણે બધાંગે જણાને કરેલા નિપમેને
આદશમાં કાપવાને નીમનાંની જરૂર પડશે. પ્રથમ તો આપણે આ

નવા મંડળમાં દાખલ થનાર સંખ્યેની બેખી અરજુ લેવી પડે, અરણુ કે પહેલેના આપણા ખરડાના વર્તનિમાં ને આપણા વર્તનિમાં ચાને ફેર પડ્યો છે, કે તેઓ સાફુકારને લથી નાથું બગર આતુ પાડ્યે ચાંદ ચુરણની શાખે લાવતાં, તેને ખર્લે હાલ આપણે ખાતામાં કે દસ્તાવેજમાં લે કાંઈ સાહુકારે ભૂલ કરી હોય તો તેનો લાભ લઈ તુરત જેસા જોટા કરાવવાની છંગા કરીએ છીએ, માટે આપણું લેખી નિયમો વિના આપણા નવા મંડળને સારી રીતે ચ્યાલાની ગણીયું નહિ નેથી કરીને મંડળમાં દાખલ થનારની અરજુ લેવી, અને આપણા મંડળનું કામ ચ્યાલાવવાને પૈસાની જરૂર પડવાની છે, માટે તે પૈસા દરેક માણ્યુસ પાસેથા શ્રી લઘ પૂરા પાડવા પડ્યો એવી રીતે શ્રી અને અરજુન્યો સહી થાપુને આસરે ૫૦૦) આવ્યા પણીથી એ તમામ ભાઈઓની એક ઉપરાંધે સલા ભરવામાં આવની નોંધાયે અને તે સભામાં આપણા મંડળમાં દરેક ભાઈઓને સુખ થાપ એવા વિષય ઉપર કહેવાની છુટ આપવી જોઈએ. તેમની વિરદ્ધમાં જેમણે કાંઈએક વિચાર દર્શાવવા હોય, તે પણ એક પણી એક માણ્યું ડિલા યધ કહી રહા બાદ અધ્યાના મત લઈ વહુભતે નિયમ પડવાનો કાયદો કરવો નોંધાયે. આ વધી બાબતો સહકારના નિયમથી બિલ-કુલ દેરાદાર નથી. દુંકમાં કલેંબાનું એલુંજ કે આપણા ખરડાના કરેલા નિયમમાં અને સહકારના નિયમમાં કાંઈપણ વદ્ધાવત દેખાતો નથી. દેર ભાત એટલોજ છે, કે ઘરડાઓને દેરતરોમાં નિયમની નોંધ ચ્યાખવાની અને દેરણી અરજુ ઉપર સહી લેવાની જરૂર પડતી ન હતી, અને આપણે દેરણી અરજુના ઉપર જે આપણું રેલાં નિયમની ઉપર તેમજ દ્રાવની ખૂબ ઉપર ચલીએ. કરવાની જરૂર ખડી છે. ઉપર પ્રભાણું આપણું બધી એ મળાને કે વહુ ઉત્તી નિયમે.

हरीमे ते अमलमां शावना अने ते प्रभाषेनुं काम यशाववा आहे
ब्बवस्थापक पंचनी जळू पडेहो. ते पंच आपणे हेवी रीते चुंटी
अद्वी ते विषे आपणे आपणा विचारोने आमण वधारीये.

प्रथम तो आपणे जे ने गामेना आणुसेहा आ नवा मंडणमा
दाखल थया हेय, ते ते गामेना नेटला दाखल थया हेय तेटलां
आणुसेही आपणे वधारे नक्की करेला हिवसे ते ते गामेना
जिकाये पोतानां गाममां एकडां थध पेता पेडी एक पंच चुंटी
अद्वी पडेहो ते पंचना आणुसेही पेता पेडी एक सर पंच चुंटी काळवो.
उडेहो. ते सरपंचने आपणा मंडणी अभिभां दाखल करवो
पडेहो जेवा रीने दरेक आममांथी एक या तो ये जेवा सरपंचे
चुंटी भाऊ पडेहो. ये वधा गामेना सरपंचे एकडां भग्ना
पोतामांथी एक अध्यक्ष एटले प्रभुभ चुट्टो, अने ते हरीने
पाणी वरसे या दूर त्रिय वर्षे चुंटणी थार त्यां चुंटी सरपंचे
तथा अध्यक्ष रहेहो; अने आपणे वधारे करेला नियमने अनुसरी
आपणा मंडणां काम करेही; अने आपणे करेला नियमां तेमनी
डेह पण आणुस विरुद्ध वर्तन करे तो आपणे तेमने आणेवा
अधिकासमांथी वातावर या अरतरह करवानी सत्ता रहेहो. ये सर-
पंचने तथा अध्यक्षने आपणे आपणा अंडणना कारबारीना
नामां जेणामीसुं, ये कारबारीयोने आपणा मंडणना कातरमां
हिसाब राखवाने एक एकेटी प्रसन्न करी नीमवानो अभिभार
आपणे पडेहो. जेवा रीने कारबारी तथा सेकेटी तमामने तेमना
गामना प्रभाषुमां घडेनलाल आपत्तु पडेहो. कासवु हे आपणे
करत झाप इतराच आणुसे होइ दिवस राखवा नाही, येवा
आपणे आपणी न्यायामुळा गारबारीयो उपर्यी लागू

છે. એ મહત કામ કરે છે, એથી આપણે ન્યાતના ડોચ પણ કામમાં એવા હેતા નથી, અને કહે છે કે અમે અમારા ધરના કામો સુક્રીને ન્યાતનું કામ કરીએ અને બીજી ભાઈઓ ગામ ઉપર આવે તેને જમાડીએ અને ડટણું નુકસાન વેહીને છીએ. જરૂર તમે તો વેર જોડા અમારી ભૂલો કાદ્યા કરે છો, અનું કહે કે અને ન્યાતનું ભલું ચાચ જોવા નિયમને હેખાડનાન ભાષુસને જાળો. પણ આપે છે. તેણો મહત કામ કરે છે, એવેલે આપણાંથી જારી રહી કાત પણ એમને કહેયાતી નથી; અને એમના ઉપકારના જોગમાં ચોર અની સારી કે નાચી ન્યાતની કાં પણ જાતો કરવાની આપણી સત્તા એની રહે છે, અને આપણને નંદો ભાઈમાં નાખે તોણે પહુંચો કરો છો. ભાટલી બધા નુકસાની જોક આપણે મહત કામ કરવાએ નેણો અની અમારી પઢે છે, મારે જાર ઝાંડને આપણા મંજાના કાગ કરનાર ભાષુસને મહેનતાશુદ્ધા પસા પરદીઠ (૩૦ ૧) આપણે દરમને શ્રી આપવી પડે તેથી કાં આપણે જરીએ અની જવાદ નથી. મારે મહેનતાશુદ્ધ તો આપનું કર; અને કોઈ મહત કામ કરવાનું કહે તો આપણે તેને કારણારીમાંથી પૂત્રનું કરવાનું કારણ કે તેને કરેલા ચુનાની આપણે સજ નદી રીતને; અને તે બધાનો ઉપરીપણુનો ગર્વ કરી તે જાણે હુઃખી ચાચ અને આપણને હુઃખી કરે. મારે આપણે ડોચ પસે મહત કામ કરાપણું નાદ, આપણે જે ને ભાષુસેને આપણા ગામમાંથી પંચ તરીકે ચુટીએ વે પ્રમાણિક, કુદ્વિદ્યાળી દ્વારા અને પરોપકારી કદ્દમના હેઠા જોઇએ. પછી તે તરંગર હોય જાતો જરીએ કોણ કે જોતે આચારણ સિદ્ધિનો હોય પણ ઉપર જાગવેના સુષુવાળ્ય રેણુ કોઈ જોઇએ. અમના પંચે મહેનતાશુદ્ધ કારણો આપણે જરીએ

જાહીનું નહિ; પણ જેઓ સરપંચમાં ચુંધા અને તેથે આપણા મંડળના કામ સાહેં બહારગામ કર્યું પડે, માટે તેમને આત્મા તરીકે એં દિવસે કામ કરવા લય તે દિવસને બોલાઈનાં આપેછે (શ. ૧) અને વધારેમાં વધારે (શ. ૨) આપવાને દરાપ કરવો પડ્યો; અને તેઓને કેટલા દિવસ રહે તેટલા દિવસનું કે હ્યાણું હ્યાપ તે પ્રમાણે અત્યું આપણું પડ્યો. આત્મા-૧ અગ્ર બીજે ખર્ચું તેઓ પોતાને ભોગીનાં અત્યામાંથી કરશ. અને અત્યાના ઈસા દરરોજ તેમની પાસેથી રસીદ લઈ રેખડા આપવા પડ્યો એ રસીદા રાથા એ વિના બીજે કાંઈ ખર્ચ યાપ તે તમામની રસીદા સેફરીટ્રી કાઢલે રાખ્યો; અને, દર વરસે આપકે જાવકેનો દિનમાં આપણું અપેક્ષા સાધારણ સભામાં વાચ્યા સંભળાવશે; તેમજ આપણું એક્ષુટ કર્યું લડોક આપણા મંડળના હોઈ પણ જામના સભામાં દેને કર્યા તરીકે દરા યા પાર આત્માના તેચીએ તેજ જામના એ સભાસદોને જામીન લઈ અમૃક મુહુતને માટે ધીરવમાં આવશે, અને તે લેખુંદારે દરાચેલી મુહુતે લીધેલી કંકનની રકમ જ્યાં સાથે લરવી પડ્યો, અને જો તે ન જારે તો જામીન પાસેથી પસુલ કરી દેવામાં આવશે. પેસાની જ્યારસ્થા કર્યા ધીરનાં અહીંપણારી મંડળીના નિયમ મુજબ જરૂરી, આવી રીતે નવા ઉકા કરવાના મંડળનું કામ બદ્ધાવવાને અધિકારીઓની નિયમશુદ્ધ કરવા જાંબસુના નિયમો નિયમ કિયાર ઝીધીએ દવે આપણે સુખી બચાના કેવા નિયમો કરવા તે કિયે નિયાર કરીએ.

પ્રયત્ન તો આપણે જેઓ પોતાન્ય કુદુરમનું કાશણપેશ્ય કર્યાની અસહત યાપ ગયા છે તેજ જરીએને અને જેઓના આપણે જાના એક્ષુટાં જરૂરી સુજરી નવા કેવા તે ઉકારાયેને વેગણ

કાપણ અજરાતી સાત ચેપડી પૂરી કરી ગેતાં છોકરાયેને જેણા સિદ્ધાયના બીજા આઈ હુંગર કિલોગ્રે. શીખવા હોય, તે જેમેં જેતાના રોજગારની સાથે નવરાશના વખતે પોતાને બેરે રહ્યા હવે કરી રહે એવા રોજગારો કાશવા ડોઈપણું રોજગાર શીખવાની છંચા હોય તેમેને મદદ કરવી લોઈએ. એને આપણા જેતાના વખતા રોજગારની કેમ અને તેમ ખાત્રવણી કરવી લોઈએ, અને કેવી બાયલમાં સહકારના સિદ્ધાંતોને હામે લગાડવા લોઈએ કારણું તે બીજે ખીંચે ગરે લાઈનું નેર વખતું જાય છે, તેથી કરીને લેણા કન્યાવિહૃદ કરતાં યાં છે. એ આપણી કોમની ગરીબાઈ યા ને કુશભરો કરતાવી બાયે છે. ડેમટ જુદે મરનો માલસાજ પેતે પોતાની છોકરી વેવી પોતાનું પેટ બરે છે. નેમેં કુલરી જાયારે પોતાના બચ્ચાને કન્ન બાયે છે, ત્યારે કેવેં પુંજુણ ભૂખ બાયે છે. તે વખતે લે ડોઈ એને પેટ બચ્ચા કેટલું ખાવાનું આપે તો એ પોતાના બચ્ચાને આરો નાંદ. નાંદ તો એને જના બચ્ચાં અતિશય બાલાં હોય છે, જ્ઞાં ભૂખના હુંઘરી એક અષ્ટ વખતનાં ભૂખના હુંઘરે અટાડવા માટે પોતે ખાઈ જઈ નાથ કરે છે. આવીજ રીતે અનુભૂ પ્રાણી પણ ભૂખના હુંઘે પશુપત સવાલાવને પામે છે, જુહુ બોલે છે, જોરી કરે છે, જુદ્ધાઈ કરે છે અને ડોઈ પણ જાતના પાપને બચ્ચુટો નથી; અને નાંદ કરવાના કામો કરે છે. સુદૂરમાઝે પણ શ્રીહંસુ અને બાળબન્દના બાગના બચ્ચા જોરીને આઈ કાઈ દીર્ઘતાનું અસાફ હુંઘ કેટલું હતુ. તેવીજ રીતે નેમેં આવા જણાનું નથી, તે પોતાની છોકરી વેવા પોતાનું પેટ બોડા વખતના બરે છે; ખાણી તો એ હુસના પેસા કર્યા ત્યાં જતા રહે છે. અમે પથારે દીક્કી થાય છે; અને પેસા આપણાંમે પણ ગરીબ

અનાવે છે. એવીજ રીત એક મરીએ થયે તે ખીલને અનાવે ખીલે ખીલને અનાવે અને ધીમે ધીમે વિહુનું લેર એટલે સુધી વધે કે પ્રિસાદારો પણ હેખાડેભી શીખી જાય છે. એનો અટકાન લે ન કરવામાં આવે તો આપી ડામની અધેગતિ થાય. ભાટે આપા મરીએ જે ને રોજગાર કરતાં હોય તે એજ ધરમાં વધારો કરવા તથા તેને જરૂરી ખીલે સાધનો મેળવી આપવામાં મદદ કરવી; અને તે પોતાની બેળે પોતાનું ચુનુરાન સારી રીતે વધાવે ત્યાંસુધી તેમને આપણું અડળમાં કંઈ ઉન્નું કરી તે હંડમાંથી પેસા ધીરવા; અને તેમની સ્વિતિ સુધર્યા પણ ધીમે ધીમે વસુદ્વા લેવા. પેસા ધર્માંદા તરીકે તો કેઢને આપી હેવા નહિ. કારણ કે વયર મહેનતે પેસા ભગતાં હેઠ; તો તે રોજગાર કરતો નહિ અને બીજત કુછદે શીખારો; તેમજ ધર્માંદાના પેસા ખાતારની શુદ્ધ જરૂર થશે. ભાટે આપણે પાઠીદાર ભાઈઓને તો ધર્માંદા પેસા અવડાવવાની છઢ્યા ન કરી જોઈએ. કારણ કે આપણે દાન આપવાને સરળબેલાં છીએ, દાન લેવાને નહિ. અરી રીતે તો આપણું ધર્માંદા બોજન જરૂરવાનો અધિકાર નથી.

કંડ શી રીતે ઉણું કરવું.

આપણે બધા ભાઈઓને કુષ્ણ ઉલ્લોગ ખણી છે, ભાટે ખોડીં ખાંધી જે ને ઉત્ત્પત્તિ હરીએ તે તે વસુદ્વાના ઉપર અધ્યાત્મે વિચાર કરી (જેઠે દ્વારાસ આર એટે અનુઃ, સુનાર આત્મી એટે અસુક વારે વારે) કરાવું અને તે હંડ પરસે ખાડના પ્રભાસ્યમાં જાગરું આને તેનું ઉચ્ચાશ્વ તે વે આત્માની જરૂરે ચોપતું. તે પેસા જરૂર

હરાવેલી મુહં સુધીમાં વસુદ કરી આપવા દ્વેદ જામતની પંચાંગ
ખરેખરસ્ત કરવો મણે અને શરીં આપનારને પંચ તરફથી રહીએ
આપની મણે, અને એ હાજાના પેસા આપળું મંડળાન ચેરમેન
નથા સેકેટરીને પહોંચાડવા પથ્યો. સેકેટરી તે તે જામતના નામે જભા
કરી રહીએ આપણે આવી રીતે પેસાની તેમજ અંગતી મદ્દ (જેવી)
કે સોંદ્રોની એટલે અરસપરસ જેતીના છામતાં મજૂર ભગતાં નહિ
દોય તો વારાકરતી એક બીજાનું કામ કરી જેતીના છામતાં તું
નાથી લેવી જોઈએ. પેસાથીજ મદ્દ અપાય તેવું કાંઈ નથી. મદ્દ
અપાય તેવું કાંઈ નથી. મદ્દ તો જેસે કે જામતની જરૂર પડે તેને
તે જામતની આપની અને લેવા, એ જામતમાં ખરેખરો સંપ કરવો
જોઈએ. નારઠોલી તાડુણના મતીઆ પારીદારોએ ઘરે આખવામાં
સંપસેખેને એકખીલને મદ્દ કરી તો એ લાકોણે થિએ ખરેખરસ
સારી જમારતો બાંધી. એવીજ રીતે સોસક સોસાખીએ જોધા વ્યા-
જના દરે મરૂ લેવાનો સંપ કર્યો તો તે મુજબ કરજ જેળાં ઓછા
વાને પોતાના જામતના સલાસદેને તેમજ બહારજામતની સોસાખીએ
પણ એછે વાને તેમજ બહારજામતની સોસાખીને પણ એછે વાને
કરકે ધીરે છે તેવીજ રીતે સોસક ડેટન જેવી સોસાખી ગામ ર૨૫
ના મંડુતો ૩૫૦ ને એકવ કરી જયા વર્ષે ૧૧૦૦). ભાર કપાસ
ખરુણે મળી પીલાની રૂકીને વેચતાં વેપારીને કપાસ વેચે તેનાં
કરતાં દર ભાર રૂ. ૨૨ (બહાર ઉપલબ્ધ એકદરે ઓઝ વર્ષમાં
આપણે ૨૪૨૦૦) વધારે મેળવ્યાં છે. એ કપાસ આપવું પોતાનું
જન કરી પીલાની રૂકી કાંતી વર્ષને જો લુગડાં આપવ્યા મંડું
જાહેરોન જાહેરોને, તો આપવ્યા જેકું કાઈનોના કેટથાં ખરુણોને
સાજગાર જેવે જાતે ખાંનાં આવુંને જાવા રેખજારથી મરીજા-

આમથી સુધે કરી શકોયે, અને આપણા ખોખાને। અહેથ્યે આજ આપણાને ભણે આવી રીતે આપણે કે કે વસ્તુઓ હિતપન કરીએ તો તે વસ્તુનો ઉપર અતાવ્યા સુધેચ એકસંપી થઈ એકખીલાને મદ્દ કરી એકખીલની બંદળીને માટે મહેનત કરીશું તો તો આપણે હિતપન કરેલાં આજાંથી બીજાંઓ કે કે લાલ મેળવી જાય છે તે તે લાલ આપણે આપણી ન્યાતતા લાદાંઓના બરમાં ઘાણી શકોયે એમ છીએ માટે કેવે તો આપણે લેછતી બીજો સામાંની લાલી ખુટક ખુટક વેંચી લેલી અને હિતપન ફેલી ચી ન એક જથે છી અગર તો કાઢા આવનો એક જનાવી વેચવાના કે દ્વારા દેખાય છે, તે લેવાને કેવે સુકૃતું ન લેછતે અને આપણે ને એકા અંદો કરવાના કે કે નિયમો રાજેલા છે. (નેવા કે જૈયા ખર્ચ રડવાનો જોગણીના ખર્ચ સીમાંત ખર્ચ વિશે) તે કેવે બને તેથી કરી કરવા લોકોએ કરણું કે ગાંધુસ ખર્ચ કરે છે તને એક કે એ દિવસના જમણુંબારમાં ૩. ૫૦૦ (યાતો ૧૦૦૦) ધાર્ય છે, ત્યારે ભવા આવનાર આશુસના બરમાં ફક્ત ૧। શેર અનાજનોઝ દ્વારા ધાર્ય. તેમાં એક આમથી બીજે ગામ જવાથી ગોતાના રોકગારમાં આડ આનાલું તુકસાન ધાર્ય છે. આ છુપથી સમજવું હે એમાં દ્વારા કરતો તુકસાન ધણું વધી જાય છે. અને ખણી આશુસિય એકડા થઈ એક પૈસાદારને ગરીબ જનાયવાના જા નિયમો છે, અને આવા નિયમોથી જોઈ મોટાઈ બહુજારી જાય છે; અને નિષ્ઠ ખળતું હોય છતાંને જોઈ મોટાઈને લઈને જાણુંને ખર્ચ કરે છે, તેઠું કાણું જો છે, તે આપણા પાદીદાર જાધારો કોણનું ખાખની શાલ થતાં નથી, જ્યાં અવદાની રાજ ધાર્ય છે; અટ ભૂમિ અસ્તા આશુસ પેલાની જાત બીજી શારીને ખર્ચ કરી જોતાને ત્યાં જાણેલી અવસર કરીએ અને પોતાની

વહેવાર ભાગ્યવરોજ. આવા રિવાજને પૈસાદીરો તો કરે પણ જેથી ગરીબ માલુસેને બજૂજ આપણણું કોળવણી કરે છે, આટે ઉપર જતાનેલા અર્થને આટે કાંઈકેક વિચાર કરવા નેતું છે. ડેટલાક કાઠમેણું કહેતું એતું છે, હું આપણું જમણુવાર સિવાય બીજું શું કરવાના. આપણા ખરડાં કાંઈ ગાંડા બાંડા ન્હોતાં ને એકબીજેને અર્થ કરતાં ગરીબ બનાને હું આ રિવાજને નીકળવાના બજી કરણો ઉપર આપણું વિવાર કરીએ.

પહેલાં કોઈ માલુસ શુંદી જતો, ત્યારે તેના વંસવાસેને ને મેળવેલા ધનમાંથી તેણે કરેલા કાંઈક પાપમાંથી મુક્ત કરવા આટે નેણો. કોઈ પણ પણ ધંધી કરવાને અસાકત હોય, નેણો. ભૂષી મરતાં હોય તેવાંઓને અને આખળા, લુલા વળે માલુસેને ધર્માદા તરીક કર્યું અનાજ આપતાં હોય એતું અનુમાન ચાય છે; અને પછી પોતાને થેરે તેવા માલુસેને રાધીને જમાડવાનો ચાલ નીકળ્યો હોય તેમ બન્યું છે. પછીથી તો આવા અપંગ અને ગરીબેને જમાડિએ અને આપણા ગામના આપણા સગાં રહે એવો વિચર કરી આપણાં સગાંવહાલાંને નોતરવા લાગ્યાં; અને તેમને ત્યાં એવો અર્થ કરે ત્યારે તે આપણું નોતરે આવો રિવાજ બાબુ થયો. નેભુને આવા નહિ અણે એવા ગરીબ અને અસાકત માલુસ પછી નહિ જમાડતાં પોતપોતાના ગામના અને સગાંવહાલાંને જમાડવાનો વહેવાર બાધ્યો એટલે જમતું અને જમાડતું. જા પ્રથા હજ સુધી આદી રહેલો છે. પહેલાં ભૂખાને જમાડતાં તેનો ભરનારને આદિ-વાંદ સળતેં ત્યારે હું વહેવારથાં વાદારો કરી આજહ માનવા લાગ્યા; અને ગરીબણી અર્થ-નહિ ચાય તો પછી ન્યાતમાંથી તેનો પટેલાં અને હજ જીનસી લેવા માંડયા અને ડેટલાક કાઠમેણોને તો છોડડો.

જરૂર-મતાની સાથે ડન્યા મળે જેમ ધારી મર્યાદાખર્ય દેણું કરીને પણ
કરવા લાગ્યા. આવા જોટા ખર્યથી આપણે આપણી મેળેજ ગરી-
ભાધ આણ્ણી છે. ભરી રીતે તો વહેવાર એ ઉધીના છે. કારણ, કે
ઉધીની આણ્ણેલી વસ્તુ જેમ પાણી આપવાની છે, તેમ દરેક જાતના
વહેવાર પણ ઉધીના છે. જેમ -ન્યાતમાં જેણે આપણે જમવાનાં
જોતરાં વખ્યાતે, તેઓ તેમને ત્યાં ખર્ય વખતે આપણને જોતરાં
સાથે, ડાખ્યું આણ્ણું આપણે જમાડીએ, તો ને આપણું જમાડે,
આપણે જેણે ચાંક્ણી કરીએ તે આપણને કરે, એવી રીતે દરેક
વહેવાર ઉધીના છે. એ વહેવાને પૈસાદારો વધારે છે, અને
ગરીબોને સાથે વહેવારમાં જોડાયું પડે છે.
જ્યારે ગરૂભને ત્યાં ઝોંઘ ખર્ય આવે, ત્યારે તેની ખર્ય કરવાની
શક્તિ નહિ હોય છતાં કેટલાડ લાઠોનો બળાતકારથી પણ તેની
પણે ખર્ય કરાવે છે; વધારે નહિ તો ગામનો વહેવાર તો તારે
સાચવવો પડશે. આની રીતે સત્તાનીને પણ આપણે તેમની પાણે
મિસ્ટાન કરાવીએ છીએ. અને જમીને છીએ. અને જમીને
છીએ. એ જમણું તે આપણું ગરીબ લાઠોનોનું ખરેખર લોડી
છે. કારણ કે એ ખર્યના પૈસા તેને વળતાં કેટલી મુસ્કેલી આગ-
વળી પડે છે તેતો વિચાર આપણે વાંરવાર લાઠોએને કરી દેવો
ત્યારે શું ખર્ય જિંબડું નહિ કરવા? આ સવાલ ઉભો ચાય છે,
તેતા જવાબમાં જણ્ણુંવાનું કે જેયતની પાછળ ધર્માં વરીદ ચાપ-
રણું, પણ વહેવાર તરીક નહિ. ધર્માં, એટલે જેણે જે જમીને
અનને આભી ચાય, કે આ જમીને મુન્ય ચાય છે, તેણે જે જમીને
આપણું. જેણે ખલાંખર્ય અને કુંબખર્ય છું છે. તેમ કરું
પણ વહેવાર વધારો અરુસ્પરસ જન્મી જમાડી ગરીબાનું આપણા

નહિ દરેક વહેવારમાં ઉપર મુજબ સમજ લેણુ કહેવાનું તાત્ત્વ
એટલું કે ધર્યાંએ મળાને એને તારવો; પણ ધર્યાં ધર્યાંએ મળીને
એહને ખુડાડવો નહિ એક દાખલો કોઈ એક શહેરમાં એક દાખ
મહાન છે તેમાં એવા હરાવ કરવામાં આવ્યો છે કે જે ડાઈનું એક
મહાન લાંઘીયા તુંડી જાય તે તમામ મહાનવાળાઓએ એક
દૂધીએંનો અને એક ઈંટ આપવી એટલે પેલા તુંડી ગયેલા મહાનને
ખાંખવાને દૂધીએંનો એક લાખ થાય એટલે મહાન બાંધનારને ફક્ત
એક દૂધીએને એક ઈંટથી મહાન ધર્યાં સાર બંધાઈ જાય અને
મદદ આપનાર ગરીબમાં પણ ગરીબ માણુસને પણ આવી જુદ
રક્મ આપતાં બીજુદુલ ઠણ પડતી નથી માટે આપણી આપી
ન્યાત એકદી મળી આવો કોઈ પણ હરાવ મદદ આપવાનો પસાર
કરે તો બધાં મળાને એક બાઈનું ગળ ઉપરાંતનું મોટામાં મોટું
સંકટ રહેવારમાં દુર થાય અને એક ભીજાઓની શહાયતાથી
દરેક અરસપરસ સુખી થાય.

આ નિયંત્ર ઉપરની આપણા ન્યાતના પટેલી બાઈઓના
અનેને એવું આવશે કે, આતો આવણી પટેલાઈ જની રહેવાની
ધારું જે માનવામાં આવશે, તો એ જુલ ગણ્યારો. કારણ કે આ
કાંઈ પટેલાઈ લાદ લેવાના વિચારણી નહિ, પણ આપણી ન્યાતમાં
એ પણ છે, તે મટાડી એકતા કરવાને આ નીતિ અને નિયમો
લખ્યા છે. એ નીતિ અને નિયમથી ને ન્યાતનું કામ ચાલે, તો
દરેક વખતે આપી ન્યાતને એકઢાં ન થણું પડે, અને આજુ અરાધ
પાડવા નહિ પડે, અને કામ જરૂરતાથી ચાલે. તેટથા વાંતે નનું
અંગ્રેજ કિસ્સુ કર્યા જિલ્લામ બે તરણી એકઢાં કરવાને જે કોઈ દાખલમાં
અનુભૂતિ હો, તો તે નિરાંતર છે. કારણ કે દરેકને પોતાપોતાના તથું

અંકિમાન હોવાથી એકવ ખર થાક એવ લાગતું નથી. તડની બોડી અમલથી આપણું અરસ્પરસ ખુલારી થાય છે; અને મંડળ રિવા જથી કરે ને વેર પૂરી જોસમાં વધતું જાય છે, માટે આપણું જોત જોતામાં નહિ ભરતાં એકબીજાને અરસ્પરસ મદદ આપી એકબીજાની પડતી કરવાનો આજે આપણું જે અડસ છે; તેવાજ અડસ અહીંની કરવામાં કર્યે લગાડવો જોઈએ. કાં તો જ્ઞાન તડા ભાંગી નાખીને અગર તો નહું મંડળ ઉષું કરીને પણ આપણે તો આપણા તમામ જાહેરોની એકત્ર કરી એકબીજાની મદદથી ચુંબી થય -ન્યાતી નિયમો આપણું ગરીબ ન જનાવે તેમજ આપણું રોજગારનો આપણું પૂરો લાભ મળે, અને આપણું પડતી અડચણો આપણું ખલા મળી ફુર કરી શકીએ, એવા વિચારથી આ નવા મંડળની બોજના ઘરી કાઢી છે. જેમ આપણા વરડાએ ન્યાતનું કામ સરળતાથી બચાવતા હતા, તેવાજ સરળતાથી આપણું બચાવીએ. આગળ પટેલ લાધાનોને માટે એ બોલ કરવા લખાઈ જયા છે, તેને માટે અમે તેમની ભારી માગીએ છીએ; અને એવા આરા રાખીએ છીએ કે આ નહું મંડળ ઉષું કરી પોતે પોતાના જામોમાં ચુંટાઈને આ નવા મંડળનો પણ કારબાર કરવાને આજે જે ઉત્સાહ એમનામાં છે, તેના કરવાં મળું વધારે ઉત્સાહથી કામ કરે; અને આણું ન્યાતના તમામ લાધાનોનું બધું કરી ગરીબોનો આધિનાંદ ભેળવે.

આપણું ન્યાતના તમામ લાધાનોને વિનિતિ કરવામાં આવે છે, કે પ્રથમ તો આપણે આ એ પહુંચી એકતા કરવાને મહેનતા કરવી જોઈએ. એ તડના આપણસો એકાં આવ નહિ, તો પણ નહું મંડળ ઉષું કરવાની પેરવી કરવી. નહું મંડળ ઉષું કરવામાં દીક

ગામના હિસચિંતક ભાઈઓને થોડીએક તરફી કેવી પડશે. તે એ
કે દર્શક પોંલખોતાના. ગામના આ નવા મંડળમાં દાખલું થવાની
ઘણ્યાવાળા ડેટલા ભાઈઓ છે, તેનું લાષ્ટ નીચેના થીરનામે મોક-
લાસું પડશે. એવા લીધે દરેક ગામથી આબ્યા પછી જો (૫૦૦) ની
સંખ્યા થશે તો આપણું અરજુઓ છપાની દરેક ગામે મોકલીં
આપણું. તે અરજુના ઉખર દાખલ થનાર અદૃષ્ટોએ સહી
ફરી શી (શ. ૧) આપવી. આપી રીતે અરજુઓ અને હીના પેસા
મળ્યા બાદ (૧૫) દિવસ અગાઉ નોટીસથી દરેક ભાઈઓને ખખર
આપવામાં આવશે તે દિવસે અને તે જખ્યાની અને તે ટાઇમે
તમામ ભાઈઓને એકથી થાસું પડશે.

ન્યાત સુધારણ અંગલના જીવાંદી

મુરધેતમલાધ ધરણારામ પેટલ.

સ્વા છપાની પ્રતિદ કરનાર
મોરારલાધ લુલાલાધ પેટલ.

સુડાને—સેસિં

રોહ—હિંદુ

વાય—રાહેર

સુરત ખોણીબા કંદલા “પર આપેલા ધો” નુ સમાચાર ગ્રીન્ટોઝ
પ્રેસમાં અંડુભાધ રામભાધ નાયો ભાષી.

આ કેળ વખતને હેતુ નીચેના પાંચ સુહ ઉપરથી સમજો

(1) ન્યાતમાં જીએ કે અણ છે તે ગરાડી જાઓ :
કેવી કરી બેદ જીએને અરસ પરસ મદદ આપી જાનેનું
અધી કરશો.

(2) અ ખલી ન્યાતમાં ઘણાં વખત ક્ષવા ચાલતા કા
નીભેટ પુરીમાંના રોડ કોઈ નિયમોથી આને ન્યાતી, જુદુ
દુઃખ આન છે. ક્ષવા નિયમો રહે કરી આપણી ન્યાતના જરીએ
અરીએ જાઈએના કે નિયમે ચાલી શકે જેવા નિયમોદી ફેલાત
ખલ તે પ્રભાસે ચલાડશાની જને જાખી ન્યાતના તમામ લાઘરે
સુધુ બાબ જેવા નન્દા નિયમે બડવાના.

(3) આપણી ન્યાતમાં કેટલાક જરીએ જાઈએના પેટાનું
સુધુરાન સુરી રીને લદ્ધ કી રહ્યા નાંડ હોય. અગર જેના માણયો
સુરી જણ રોન કેન અનુભ વયેલા જ્યાંડો તથા સુજરતો સાત
ચે પણી અણી રહ્યા પણી ખોળ મેઠ વિદો મેળનવાની છંગાવાના
રીધારીએ રેમજ હુલરડળા ડરીઅનીનું કાન અગર રોમખણ રેણ-
ગુર વગેરે શીખનારાયેને તથા અપણી તથા નીરસાર જાણતા,
થયદ્ય રુદ્ધોન ન્યાતી ઇડાંથી જાદુ આપવાનો.

(4) દાઢે દાઢે અસુખ્યો એળા કરી જાય છે. રૈમનું
નેર વધતું જરૂર છે. ન્યાત જોઈ કરી જાય છે. અનેજરીનાનું
નેર દધતું જરૂર છે. મારે અહાર્યનું ખાલન કરી રીત્થ આપુંધ
રોગ રહ્યાન જગતાન જને ધનવાન જીવનવાનો.

(5) જેતીમાંથી આપણે કે કે વસ્તુ ઉત્તેજ ડીજે છીએ
તે તે વરસુયોનો શરૂઆતમાંથી પડો જનાપવાનો. જાગર જાણો
જ્યાં માત્ર એકજ કરી બેન્દાની જને કે કે બેન્દે આપણે ઉત્તેજ
ડી શાલી નહિ હોય કેવી જરૂરી જરૂર ની વરસુયો. જ્યાંથી જન્મેના
દિન દૂધ વહેંચી જનેનો.

